

## **NALIN® LEASE FINANCE LIMITED**

CIN: L65910GJ1990PLC014516

NLFL/2021-22/BSE997

Date: - August 3rd, 2021

To, THE SECRETARY, **BOMBAY STOCK EXCHANGE LTD.,** 25<sup>TH</sup> FLOOR, PHIRBZE JEEJEEBHOY TOWERS, DALAL STREET, **MUMBAI -400 001,** 

Scrip Code: -531212

Dear Sir,

Sub: -Submission of newspaper advertisement as per Regulation 47 of SEBI (Listing obligation and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copies of the newspaper advertisements published in both the English and Gujarati edition of Western Times regarding the publications of the Unaudited Financial Results of the company for the quarterended on30<sup>th</sup> June, 2021.

Kindly take the above information on your records.

Thanking you. Yours Faithfully

FOR NALIN LEASE FINANCE LIME

NIKULKUMAR KANTIBHAI I CHIEF FINANCIAL OFFICER

Encl: As above





લહેરનો પ્રકોપ હજુ ખતમ થયો નથી

અને હવે નિષ્ણાંતોએ ત્રીજી લહેરની

ચેતવણી જારી કરી દીધી છે.

નિષ્ણાંતોએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર

આવી શકે છે. જેમાં દરરોજ એક

લાખ નવા કેસ જોવા મળી શકે છે.

સાથે તેમણે કહ્યું કે, ખરાબ સ્થિતિમાં

કેસ દોઢ લાખ સુધી પહોંચી શકે છે.

નિષ્ણાંતો પ્રમાણે ઓગસ્ટ મહિનામાં

ઓક્ટોબરમાં પોતાના પીક પર જઈ

વ્યવસ્થાની તસવીર ડરાવી રહી હતી પરંતુ જો ત્રીજી લહેરમાં પણ આવી

થનારી ત્રીજી લહેર

બીજી લહેરમાં લાચાર સ્વાસ્થ્ય





"ગરીબો કી સુનો , વો તુષ્કારી સુનેગા" આ પંક્તિ જાણીતી છે . પરંતુ અમદાવાદ શહેરના જૂદા-જૂદા-જૂદા-જૂદા-જૂદા-જૂદાન જૂદાને નોએ , બસ સ્ટેન્ડો પર આ જ ગરીબ લોકોએ અડીંગો જમાવી દીધો છે . વળી "સ્વચ્છતા" નામે મીડું જ જોવા મળે છે . કૂટપાથ એટલી ગંદકી કરી નાંખે છે કે ત્યાંથી નીકળવુ મુશ્કેલ થઈ જાય છે. ખસ સ્ટેન્ડો પર તેમનો સામાન મૂકી દે છે. પરિણામે સામાન્ય મુસાફરો બસની રાહ જોઇને ઉભા રહે છે તેમને બેસવાની જગ્યા રહેતી નથી .કોર્પોરેશન બસ સ્ટેન્ડો પાછળ હજારો રૂપિયા ખર્ચી નાંખે છે પરંતુ મુસાફરોને બેસવા ન મળે તો આવા બસ સ્ટેન્ડો શા કામના ?? કોર્પોરેશનના દબાઇખાતાને આ બાબત નજરે પડતી નહી હોય ? રાજય સરકારે લાખો રૂપિયાના ખર્ચે સેલ્ટરહોમ બનાવ્યા છે પરંતુ તેમાં કોઈ જ રહેતુ નથી અને રસ્તા પર આવા લોકો પોતાનું સામ્રાજ્ય જમાવી દે છે . ફ્રૂટપાથો રાહદારીઓને માટે ચાલવા હોય છે પરંતુ ફ્રૂટપાથ પર જગ્યા જ હોતી નથી .કોર્પોરેશનના રેકર્ડ પર ફ્રૂટપાથ હોય છે પરંતુ અમુક જગ્યાઓ પર તો ચાલવાની જગ્યાઓ હોતી નથી દબાણોની આ બબાલમાં ખરેખર કોણદબાય છે. દબાણર્કતા , સરકાર કે પ્રજાજન ?? આવા દબાણોના કારણે ગમે તેટલા રસ્તા ખુલ્લા હોય પરંતુ ટ્રાફિકની આવન-જાવન માટે વિધ્નરૂપ સાબિત થાય છે. પરિણામે સત્તાધીશો ગમે તેટલા રસ્તા પહોળા બનાવે પણ દબાણોના કારણે શહેરની રોનક ઢંકાઈ જાય છે. સ્વાભાવિક છે કે અહીંચાથી પસાર થતા લોકો અમદાવાદ ગંદુ છે અને સ્વચ્છ નથી તેવી માનસિકતા લઈને જાય છે. ( તસ્વીર:- જયેશ મોદી )

## મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્ચો

### ઓસી. ને હરાવી ભારત પ્રથમ વખત હોકીની સેમિફાઈનલમાં

ટોક્ચોથી ભારત માટે સૌથી ખશીના સમાચાર આવ્યા છે. ભારતીય મહિલા હોકી ટીમે દમદાર પ્રદર્શન કરી સૌ પ્રથમ વખત ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રાની રામપાલની પ્રવશ કયા છે. રાના રામપાલના આગેવાનીમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં ૧-૦થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય પુરૂષ ટીમ બાદ મહિલા ટીમ પણ હોકીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પહોંચી છે. હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો સામનો આર્જેન્ટીના સામે થશે. ઓલિમ્પિકમાં સતત બીજા દિવસે

હોકીએ સારા સમાચાર આપ્યા છે. હાંકાએ સારા સમાચાર આપ્યા છે. રવિવારે ભારતીય પુરૂષ ટીમે ગ્રેટ બ્રિટનને હરાવી ૪૯ વર્ષ બાદ સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે તો આજે ભારતીય મહિલા હોક્રી ટીમે વિશ્વની દમદાર ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે રાની રામપાલની મહિલા હોકી ટીમ ભારતના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ



કૌરે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને લીડ અપાવી હતી. ઓલિમ્પિકમાં ગુરજીતનો આ પ્રથમ ગોલ છે. ભારતીય મહિલા હોકી ટીમે

કરી હતી. ભારતીય ટીમનેં આ

કરી શકી નહીં. શર્મિલાની પાસે ૧૧મી મિનિટે તક હતી. ભારતીય મહિલા હોકી ટીમે પોતાની અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

# બે મેચોમાં આયર્લેન્ડ અને સાઉથ આફ્રિકાને હરાવી છ પોઈન્ટ સાથે હતી. ટીમ પૂલ એમાં ચોથા સ્થાને

તબાહી જોવા મળી તો દેશ માટે તબાહા જાવા મળા તા દરા માટ સ્થિતિ મુશ્કેલ બની શકે છે. હૈદરાબાદ અને કાનપુર આઈઆઈટીમાં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં શોધકર્તાઓનો હવાલો આપતા સાયકારા તા હવાવા આવા બ્લૂમબર્ગે જણાવ્યું કે, કોરોનાના કેસમાં થઈ રહેલી વૃદ્ધિ ત્રીજી લહેરને આગળ વધારશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં તે પિક પર પહોંચી શકે છે. નિષ્ણાંતોએ કહ્યું કે કેરલ અને મહારાષ્ટ્રમાં જે રીતે કેસ સામે આવી રહ્યાં છે તેનાથી સ્થિતિ ખરાબ થઈ શકે છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર, બીજી લહેર જેટલી ખત્રનાક

## કોરોનાની ત્રીજી લહેરનો કહેર ઓગસ્ટમાં જોવા મળશે ભારતમાં કોરોનાની બીજી

અનુમાન એક ગણિતીય મોડલ પર આધારિત હતું. મેમાં આઈઆઈટી હૈદરાબાદના એક પ્રોફેસર, વિદ્યાસાગરનું કહેવુ હતુ કે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ આવનારા દિવસોમાં ગણિતીય મોડલના આધાર પર પીક પર હોઈ શકે છે. ભારતમાં રવિવારે કોરોનાના ૪૧૮૩૧ નવા કેસ સામે આવ્યા અને ૫૪૧ લોકોના મૃત્યુ થયા હતા. કેન્દ્ર સરકારે કેરલ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના ૧૦ લાજ્યોને ચેતવણી આપી છે કે વધતા સંક્રમણ વચ્ચે અને કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે પગલા ભરવા જોઈએ. નિષ્ણાંતોએ તેવણી આપી છે કે કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ ચિકનપોક્સની જેમ સરળતાથી

ફેલાય શકે છે અને વેક્સીન

મહેસાણા અને જોરણંગ ખાતે

સંવેદના દિવસ -સેવા સુતા કાર્યક્રમમાં

ત્તવદત્તા દિવસ ન્સવા સુતા કાવક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે કોરોના દરમિયાન વાલીનું છત્ર ગુમાવનાર બાળકોના વાલી બની નોંધારાનો આધાર આ સરકાર બની છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સુશાશન દિવસની ઉજવણી નહિ

પરંતુ જૅનહિતકારી યોજનાઓને થકી

છેવાડાનો માનવીનો વિકાસ થાય તે

અમારો ધ્યેય છે. નાયબ મુખ્યમંત્રી

લેનારામાં પણ ફેલાય શકે છે.

અનુસંધાને તા. ૨/૮/૨૦૨૧ના રોજ સેવા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા वडीवटी तंत्रना संयुक्त ઉपक्रमे સવારે ૦૯.૦૦ વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન્ કરવામાં આવેલ. જેમાં શહેરના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુક્ત રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ અને ઈસ્ટ ઝોન માટે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો હતો.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતેના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ

છેવાડાનો માનવી સરકારની ચોજનાનાના લાભોથી

વંચિત ન રહે એ જ અમારો નિર્ધારઃ નીતિન પટેલ

કપરા સમયમાં વિકાસયાત્રાને અટકવા

દીધી નથી. રાજ્યમાં દોઢ લાખ કરોડથી

વધુ વિકાસના કામો થઇ રહ્યા છે તેમ

જણાવી ઉમેર્યું હતું કે ગુજરાતનો વિકાસ,પ્રગતિ,સુખ શાંતિ,સલામતી

અને ગૌરવ આગળ વધે તે

કાર્યપ્રણાલીથી સરકાર સૌના સાથ સૌના

વિકાસથી કામ કરી રહી છે નાયબ

મુખ્યમંત્રી નિતીન પટેલે ઉમેર્યું હતું કે

કોરોનાની મહામારીમાં હજારો

વ્યક્તિઓને જીવન ગુમાવ્યું છે તેમના બાળકો પ્રત્યે સંવેદના દાખવી માસિક રૂ

૪૦૦૦ અને કોઇ એક વાલી અવસાન

પામલે હોય તો માસિક રૂ.૨૦૦૦ની

સહાય સરકાર દ્વારા આપવાની

દેવાદારો/ જામીનદારોના નામો

શ્રી. ચિરાગકુમાર લાડોલા, શ્રીમતી. ભુમીકાબેન ચિરાગકુમાર લાડોલા

શ્રી. હિરેન બી પટેલ.

pect No.IL10006993, IL10100175

ર્તી. મુનાભાઇ જગાભાઇ ભુવા ત્રી. જગાભાઇ વશરામભાઇ ભુવા ત્રીમતી. જસુબેન મુનાભાઇ ભુવા Prospect No.846236, 933108, 921246)

શ્રી. રમણભાઇ મંગલભાઇ સોલંકી, શ્રી. ચંદ્રકાંત રમણલાલ સોલંકી, શ્રીમતી. દાનલસ્મીબેન ચંદ્રકાંત સોલંક શ્રી.ગણપતભાઇ રમણભાઇ સોલંકી, શ્રીમતી. મધુબેન ગણપતભાઇ સોલંકી (Prospect No.806525)

નિતીન પટેલે ઉમેર્યું હતું કે કોરોનાના આ ૧૩૨ જેટલા બાળકોની ઓળખ થઇ છે

શરૂઆત થઇ છે. મહેસાણા જિલ્લામાં વિકાસ થાય તે દિશામાં કામ કરી રહી છે.

દિવસમાં અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. કોઇ પણ રાજ્યના વિકાસની પ્રાથમિક શરતો રાજકીય સ્થિરતા, રાજકીય ઈમાનદારી, ઇચ્છાશક્તિ, निर्शायकता, संवेदनशीसता, પ્રગતિશીલતા છે. આપર્શા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશનું સુકાન સંભાળી રહેલ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે જનભાગીદારીના આધારે વિકાસનો જે પાયો નાખ્યો

હતો, ત્યાંથી આગળ વધતા સરકારે ગુજરાતની પ્રગતિ માટે શ્રેણીબદ્ધ વિકાસકામો કર્યા છે અને ભવિષ્યમાં પણ આ સિલસિલો જળવાઈ રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ

જેઓને આ સહાય અપાઇ રહી છે.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉમેર્યું

હતું કે કોરોના સમયમાં પ્રજાને મુશ્કેલી

કે અગવડ વેઠવી ન પડે તે માટે સરકારે

અનેક કાર્યો કર્યા છે. નાયબ મુખ્યમંત્રી

નિતીન પટેલ જણાવ્યું હતું કે રાજ્ય

સરકાર વિકાસને વરેલી છે.

ખેડુતો,વંચિતો અને છેવાડાના માનવીનો

વિકાસ થાય તે દિશામાં ટેકનોલોજીના

સમનવ્યથી સરકાર આગળ વધી રહી છે.તેમણે ઉમેર્યું હતું કે ભુતકાળમાં ગામડાઓના વિકાસ તરફ દુર્લક્ષ્ય સેવાતું

હતું પરંતુ આ સરકારે ગોકળીયું ગામ,જ્યોતિ ગામ યોજના સહિત અનેક

વિધ ગ્રામલક્ષી યોજનાથી ગામડાઓનો

ડીમાન્ડ નોટીસ

સિક્યોરિટાઇઝેશન એન્ડ રિક્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સનેટ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયઠો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ની સાથે વાંચતા, આઇઆઈએકએલ ગુહ ફાઇનાન્સ લિમિટેડ (ાાદ પ્રાદ્મ) (અગાઉ ઇન્ડિયા ઇન્ફોલાઈન હાઇસિંગ ફાઇન લિમિટેડ)ના અધિકૃત અધિકારીએ જારી ક્યાં છે. ઉપરોક્ત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગણી નોટિસ, ઉલાર લેનાર (ઓ) ને, એનો સંબંધિત પ્રેપ્ત નોટિસ (ઓ)માં જણાવેલ ૨૬મ ૧૨૦ કરવા માટે હાકલ કરે છે. ઉપરના સંબંધમાં, ફરીશી આ સુચના પ્રકાશિત થયાની તારીખલી ૯ ૦ દિવસની એંદર લેલાદાર (ઓ)ને યુક્વણી કરવા માટે સુચના આપવામાં ઓવી છે, તા વધુ વ્યાજ સાથે, નીચે જણાવેલ ૨૬મ, ઓ માંગણી સુચના અને લોનની ૨૬મની ચુકવણી માટે આપવામાં આવતી સુરશા નીચે મુજબ છેઃ -

Shinos લોટોસ તારીખ અને રકમ 30-July-2021 Prospect No.IL.10006933 Rs.21,03,376' (રૂપિયા એકવીસ લાખ ગલ હજાર ગલસો છોત્તેર કન) Prospect No.IL.10100175 સેકીસેલા બાખ ગલ હજાર ગલસો છોત્તેર કન) Prospect No.IL.10100175 Rs.2,44,847'. (રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજાર આઠસો સુડતાલીસ કન્ન) અમદાદાદ, ગુજરાત, ભારત, પીનાનીક-કન્ટરહન્ટર ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

29-July-2021 Prospect No.859505 Rs.15,42,497.00!- (રૂપિયા પંદર લાખ બેતાલીસ હજાર ચારસો સત્તાર્ણ કકત) Prospect No.855994 પ્રેકર રોડ, મોટા વરાછા, સુરત, ૩૯૪૧૦૧, ગુજરાત, ભારત Rs.13,22,431.00<sup>.</sup> (રૂપિયા તેર લાખ બાવીસ હજાર ચારસો એકતીસ કકત) ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત Prospect No.95494 Rs.3,06,076.00<sup>.</sup> (રૂપિયા ત્રણ લાખ છ હજાર છોતેર કકત)

29-July-2021 Prospect No.846236 Rs.12,04,841.00/- (રૂપિયા ખાર લાખ ચાર જાજ આઠસો એકતાલીસ કન) Prospect No.9333108 મુળી, રામજી મંદિર પાસે, સુરેન્દ્રનાગર, 3530eર, ગુજરાત, Rez.25,9678.00/- (રૂપિયા બે લાખ) વારાલાઇડ લાજ રહ્યા કેઇલ્યોરે દરકા, Prospect No.921246 Rs.2,61,423.00/- (રૂપિયા બે લાખ એક્સક લાજર

29-July-2021 Rs.10,66,329.00 (રૂપિયા દસ લાખ છાસઠ હજાર ત્રલસો ઓગલત્રીસ કક્ત) પ્રત્યા કક્ત એગલત્રીસ કક્ત) કેલનપુર, વડોદરા, ડભોઇ રોડ, વડોદરા-૩૯૦૦૧૬, ગુજરાત, ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

28-July-2021 Rs.14,63,679.00/- (રૂપિયા ચોદ લાખ ત્રેસઠ હજાર છસો અગણ્યા એંસી ફક્ત) અગણ્યા એંસી ફક્ત ) કુરત, ગુજરાત, ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ બાગો સહિત

સહી/- અધિકૃત અધિકારી, IIFL હોમ ફાઇનાન્સ લીમીટેડ (IIFL HFL)

કોરોના કાળમાં બધું થંભી ગયું હતું ત્યારે પણ સરકાર લારા પ્રજા ઉપયોગી કાર્યો ચાલુ રહ્યા હતા: રૂપાણી જાણાવ્યું હતું કે, કોરોના મુખ્યમંત્રી વિજયભાઈ સુપાણીના દ્રપમાં જન્મદિવસના "સેવા યજ્ઞ" હાથ ધર્યો છે. નવ સરકાર હારા પ્રજા ઉપયોગી કાર્યો સ્વર્ગ હતું સ્વારે પણ સરકાર હારા પ્રજા ઉપયોગી કાર્યો સ્વર્ગ હતું સ્વારે પણ સરકાર હારા પ્રજા ઉપયોગી કાર્યો સ્વર્ગ હતું સ્વારે પણ સરકાર હારા પ્રજા ઉપયોગી કાર્યો સ્વર્ગ હતું સ્વારે પણ સરકાર હારા પ્રજા ઉપયોગી કાર્યો સ્વર્ગ હતું સ્વારે પણ સરકાર હારા પ્રજા ઉપયોગી કાર્યો સ્વર્ગ હતું સ્વર્ગ કર્યો સ્વર્ગ કર્યા હતું સ્વર્ગ કર્યા હતું સ્વર્ગ કર્યો હતું સ્વર્ગ કર્યા હતું સ્વર્ગ કર્યા હતું સ્વર્ગ કર્યા હતું સ્વર્ગ કર્યો કર્યા કર્યા હતું સ્વર્ગ કર્યો કર્યા કર્ય ચાલુ રહ્યા હતા. એ ખરેખર "સેવા યજ્ઞં' છે. આ કપરા સમયમાં પણ રૂ.૧૬,૦૦૦ કરોડના વિકાસ કાર્યો સરકારે કર્યા છે. આજના દિવસે સાચા અને નાના લાભાર્થીઓ લાભથી વંચિત રહી ન જાય અને ખોટા લાભાર્થીઓ લાભ ન લઇ જાય તેની ચિંતા સરકારે કરી છે. અમારી સરકાર લોકોની આકાંક્ષા પૂરી કરવાવાળી સરકાર છે. અમે વોટ બેંક ઉભી કરવા માટે નહિ પરંતુ, લોકોના હિત અને પ્રગતિ માટે આવ્યા છીએ. અમારી સુરકાર સત્તા માટે નહિ પરંતુ, લોકોની સેવા માટેની સરકાર

> અત્યાર સુધીના સેવા સેતુના કાર્યક્રમોમાં કરોડો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો છે. હવે સરકાર ઈ-સેવા સેતુની નવી પહેલ કરશે. લોકોને દરરોજ સમયસર સેવાનો લાભ મળતો રહે તે માટે આયોજન કરેલ છે. મુખ્યમંત્રીએ એમ કહ્યું કે, સરકાર પારદર્શકતાના આધાર પર ફેઈસલેસ વ્યવસ્થા, અલગ અલગ વિભાગમાં ઓનલાઈન સેવા શરૂ કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નિર્ણા યુકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર સરકાર પોતાની ભૂમિકા નિભાવશે જ, તેવી હું ખાતરી આપું છું. પારદર્શકતાના આધાર પર ભ્રષ્ટાચારને દુર કરવા રાજ્ય સરકાર સંખ્યાબંધ નિર્ણયો લઈ રહી છે. જેને પ્રચંડ જ્નસમર્થન સાંપડી રહ્યું છે. રાજ્યને વિકાસનું રોલ મોંડેલ બનાવવાની સાથે સમૃધ્ધિ તથા પ્રગતિના પથ પર સદાને માટે અગ્રેસર બનાવવા માટે રાજ્યના નાગરિકોની ચેતનાને જગાડવા માટે રાજ્ય સરકાર સદા પ્રયત્નશીલ રહી છે.

#### પ્રથમ ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન રહી. દરેક પૂલની ચાર ટીમો નોકઆઉટ સ્ટેજમાં પહોંચે છે. રાની રામપાલની આંગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ ટીમનું ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ એકપણ ગોલ ન કર્યો પરંતુ ગોલ પ્રદર્શન ૧૯૮૦માં મોસ્કોમાં રહ્યું થવા દીધો નહીં. ટીમે સારી શરૂઆત હતું જ્યારે તે છ ટીમોમાં ચોથા સ્થાર્ને

# મધ્યપ્રદેશમાં રેડ અલર્ટ; બંગાળમાં પૂરમાં રેસ્ક્યૂ કરી રહેલાNDRFના 3 જવાન ગુમ નવીહિલ્હી, શિવપુરી, ગુના, અશોકનગુર, જિલ્લાઓમાં નદીઓ બે ક્રાઇ વહી

ભારે વરસાદને કારણે દેશમાં હાહાકાર મચી ગયો છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં સતત વરસાદને કારણે યમુના બે કાંઠે વહી રહી છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. બીજી બાજુ, બંગાળના હુગલીમાં પૂર દરમિયાન રેસ્ક્યૂ કરી રહેલા NDRFના ત્રણ

જવાન ગુમ થયા છે. જાણો, મુખ્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ ... દિલ્હીમાં યમુના ખાદર ખાતે બોટોને તહેનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વહીવટીતંત્રે વિસ્તારોમાં રહેતા ૧૦૦થી વધુ પરિવારોને હંગામી રૂપે તંબુઓ અને રેનબસેરામાં સ્થળાંતેર કરવાનું કામ શરૂ થયું છે. દિલ્હીમાં અવિરત વરસાદ અને હથની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવતાં યમુનાનો જળસ્તર ભયજનક નિશાન ૨૦૫.૩૩ મીટરની આસપાસ નોંધવામાં આવ્યો છે. વહીવટીતંત્રે પુરની ચેતવણી જારી કરી દીધી છે. સૌમવારે પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે.

હવામાન વિભાગે ગ્વાલિયર,

પશ્ચિમ રેલવે – ભાવનગર ડિવિઝન

એમજી સેક્શનના ઓએફસી હટ્સનું પુનઃસ્થાપન

**ઈ-ટેન્ડર નં.** 39/2021-22. કામનું નામઃ ભાવનગ

ડિવિઝન :- ચક્રવાત તૌકતે દ્વારા થયેલ નુકસાનના સંબંધમ

એમજી સેક્શનના ઓએફસી હટ્સનું પુનઃસ્થાપન. (સંલગ્ન સૂચિ મુજબ). **ટેન્ડર મૂલ્યઃ** ₹ 37,02,206.84

ઈએમડીઃ ₹74,100.00. બિડીંગ શરૂ થવાની તારીખઃ

13-08-2021, બિડીંગ <mark>બંધ થવાની તારીખઃ</mark> 27-

08-2021. એનઆઈટી રેલવે વેબસાઈ

www.ireps.gov.in પર 30-07-2021 ના રોજ

અમને ફોલો કરોઃ 📂 twitter.com/WesternRly

નામ બદલેલ છે

મે મારૂ જૂનુ નામ શ્ચામકુમાર

હેમાંગભાઈ પટેલ હતું જે બદલીને

**શ્ચામ હેમાંગકુમાર પટેલ** કરેલ

છે. **સરનામું** : એ-૬૬, રીમા પાર્ક

સોસાયટી, રાયચંદનગરની

પાછળ, મોટેરા, સાબરમતી,

અમદાવાદ-૩૮૦૦૦૫

<u>નામ બદલેલ છે</u>

મારૂ જુનું નામ : લેઉવા હસમુખકુમાર

પુરષોત્તમભાઈ હતું જે બદલીને

નવું નામ : લેઉવા હસમુખભાઇ

પુરધોત્તમભાઇ કરેલ છે.

સરનામું : મુ.પો.મોયદ-નાથાજી, ı. પ્રાંતિજ, જિ. સાબરકાંઠા-૩૮૩૧૨૦.

લેસ્ટર્ન ટાઇમ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

જાહેરાતો અંગે વાંચકોએ

પોતાની રીતે ચકાસણી કરી

-જાહેરખબર મેનેજર

નિર્ણય લેવો.

દતિયા, શ્યોપુર, મુરેના, ભીંડ, નીમચ અને મંદસૌર માટે ભારે વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન્ વિભાગે કહ્યું હતું કે આ વિસ્તારોમાં આગામી ર૪ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રાજધાનીમાં સતત વરસાદ ચાલુ છે. મોટા ભાગના ગયા છે.

રહી છે. રીવામાં ૩૦૦ પરિવારોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. ભીંડ, શ્યોપુરનાં ઘણાં ગામો પૂરમાં ઘેરાઈ ગયાં છે. જબલપુરના સોહાગી પર્વતમાં ભૂસ્ખલન થયું છે.પર્વતના પથ્થરો નેશનલ હાઇવે ૩૦ પર આવીને પડી

## આંતરરાષ્ટ્રીય ફિટનેસ કંપની(HYPOXI) હાયપોક્સીએ

વજન ઘટાડતી બ્રાન્ડ હાયપોક્સી સ્ટુડિયોએ સિંધુભવન રોડ પર પોતાનો પહેલો સ્ટુડિયો શરૂ કર્યો. હાયપોક્સી અમદાવાદીઓ માટે નવીન. અત્યંત અસરકારક. લક્ષિત ચરબી બર્નિંગ સારવાર લાવે છે. આયુષી વ્યાસ (ઓપરેશનલ હેડ, ફિટનેસ એક્સપર્ટ) જિમી અસીજા (ફ્રેન્ચાઈજી ઓનર અને ડિરેક્ટર, હાયપોક્સી) જતીન શમાની (ફ્રેન્ચાઈજી ઓનર અને ડિરેક્ટર હાયપોક્સિ) અને ટ્વિંકલ શર્મા (અભિનેત્રી) લોન્ચિંગ ઇવેન્ટમાં હાજર હતા.

આયુષી વ્યાસ (ઓપરેશનલ હેડ, ફિટનેસ એક્સપર્ટ) એ કહ્યું ''આંતરરાષ્ટ્રીય ફિટનેસ અને વેઇટ લોસ બ્રાન્ડે અમદાવાદ શહેરમાં

અમદાવાદમાં પોતાનો પહેલો ફિટનેસ સ્ટુડિયો શરૂ કર્યો

**અમદાવાદ,** પ્રથમ સ્ટુડિયો ખોલવાની જાહેરાત આંતરરાષ્ટ્રીય ફિટનેસ અર્ન કરી. હાયપોક્સી પહેલાથી જ પ૦ થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. અમદાવાદમાં હાયપોક્સી લોન્ચ કર્યા બાદ હવે અમદાવાદી પબ્લિક સરળતાથી વર્કઆઉટ કરી શકે છે.

જિમી અસિજા (ફ્રેન્ચાઇજી ઓનર અને ડિરેક્ટર, હાયપોક્સી) દ્વારા આમાં વધુ ઉમેરવામાં આવ્યું શરીરમાં પાણીની જાળવણી અને લોહીના પ્રવાહના સ્તરને સંતુલિત કરવામાં મદદની વાત આવે ત્યારે હાયપોક્સી ટેકનોલોજીને ખૂબ જ સક્ષમ તકનીક માનવામાં આવે છે. આ સારવારની મદદથી, વ્યક્તિઓ તેનો મોટો ફાયદો મેળવી શકે છે. આ ટેકનોલોજી યોગ્ય દબાણની લય વિકસાવવામાં મદદ કરે છે, જે એકંદર રક્ત પરિભ્રમણને સુધારે છે અને

શરીરના ચયાપચયને પંપ આપે છે.

સહી/-

ક્વર્જીભાદ તકભવભાદ તકુલ

મેનેજાંગ ડાયરેક્ટર

(DIN: 00023332)

સુરભી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ CIN NO. L17110GJ1992PLC017672 **રજી. ઓફિસ** : 'સુરભી હાઉસ' બીજો માળ, એફ.પી. નં.૨૦૬, જુની સબ જેલ પાછળ, રીંગ

સેબી (લિસ્ટીંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડીસ્ક્લોઝર રીક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ના રેગ્યુલેશન ૩૩ તેમજ રેગ્યુલેશન ૪૭ અનુસાર, **નોટિસ** આપવામાં આવે

વધુ વિગતો કંપનીની વેબસાઇટ www.surbhi.com તેમજ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com પર પણ ઉપલબ્ધ છે.

તારીખ : 0૨.૦૮.૨૦૨૧

રોડ, ખટોદરા, સુરત, ગુજરાત-૩૯૫૦૦૨ નોટિસ

છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક **૧૦મી ઓગસ્ટ, ૨૦૨૧** ના રોજ **બપોરે** ૧૨.૧૫ વાગ્ચે કંપનીની રજીસ્ટર્ડ ઓફીસ ખાતે અન્ય કામકાજની સાથે ૩૦મી જૂન, ૨૦૨૧ના રોજ પૂરા થતા કંપનીના ત્રિમાસીક અંત માટેના અનઓડિટેડ નાંણાકીય હિસાબો મંજૂર કરવા અને રેકોર્ડ કરવા મળશે.

બોર્ડના આદેશ અનુસાર સુરભી ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ,

સ્થળ : સુરત

ડો. સ્મૃતિ પટેલ ર્અમ.બી.બી.એસ. એમ.ડી. પીડીયાટ્રીક્સ પીડીયાટ્રીક <del>ન્</del>યુરોલોજીસ્ટ (CMC, VELLORE)

હવેથી પીડીયાટ્રીક ન્યુરોલોજીસ્ટ આણંદ શહેરમાં ઉપલબ્ધ <u> દર શનિવારે</u>

શું તમારુ **બાળક/કિશોર...** - બેસવા, ચાલવા, બોલવા અને સમજવામાં મોડુ છે ? - વારંવાર, લાંબી, તાવ સાથે /વગર ખેંચ/વાઈની તકલીફ ધરાઈ રહ્યો છે ? વારવાર, લાખા, તાવ સાથ /વંગર અવાયાંગત તકલાક વરાઇ રહ્યા છે ! અસમાન્ય વર્તપૂર્ણ અથવા ચંચળતા ધરાઈ રહ્યા છે ! વારંવાર બોલવવા છતા ધ્યાન ન આપવુ અને એક ને એક વાતનું અનુકરણ કરે છે ! વારંવાર માથાના દુખાવાની તકલીકમાંથી પસાર થઈ રહ્યું છે ! ચાલવામાં અસંતુલન ધરાઈ રહ્યાં છે ! ચાલતા - ચાલતા પડી જાય છે ! જો હા તો આપે તાત્કાલિક પીડીયાટ્રીક ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ

નીચે દર્શાવેલ રોગોની સારવાર હવે શક્ય છે તમારા શહેરમાં... વાઈ/ખેંચની તકલીફ, આદાશીશી/માથાનો દુખાવા, સેરીબ્રલ પાલ્સી, જી.બી.એસ નસોની તકલીફ), ડેવેલેપમેટસ ડીલે, ઓટીઝમ/એ.ડી.એચ.ડી. , લકવો, સ્નાયુની તકલીફ, મગજનો તાવ, મગજની ગાંઠ

ઉપલબ્ધ સેવાઓ

મગજની પટ્ટી, નસ અને સ્નાયુની તપાસ, બહેરાશની તપાસ સમયઃ શનિવાર (૧૦ થી ૧)

\_\_\_\_\_ પરીમલ હેલ્થ કેર, નયાપડકાર પ્રેસની બાજુમાં, સ્ટેશન રોડ, આણંદ, -૩૮૮૦૦૧

#### સાનબ્લ્યૂ કોર્પોરેશન લિમિટેડ રજી. ઓફિસ : 22- A, ગવર્મેન્ટ સર્વન્ટ સોસાયટી, મ્યુનિસિપલ માર્કેટ પાસે,

સી.જી. રોડ, અમદાવાદ-380009 Email : inquiry@sanbluecorporation.com • Website : www.sanbluecorporation.com

CIN: L15400GJ1993PLC020073 ചിടിപ്പ

હશે નહીં, જ્યારે દેશમાં દરરોજ ૪

લાખ કેસ સામે આવી રહ્યાં હતા.

આ વર્ષે કોરોનાની સ્થિતિ વિશે

30 જુન, 2021ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળાના બોર્ડ મીટીંગની જાણ બાબત

આથી નોટિસ આપી જાણ કરવામાં આવે છે કે શુક્રવાર, 13 ઓગસ્ટ, 2021ના રોજ બપોરે 4:00 કલાકે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ખાતે નીચે દર્શાવેલી બાબતો અંગે વિચારણા તથા તેને મંજૂર કરવા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની

૧) 30 જુન, 2021ના રોજ પૂર્ણ થયેલાં કંપનીના પ્રથમ ક્વાર્ટર ગાળાના અનઓડિટેડ નાણાંકીય પરિણામોની મંજૂરી માટે

૨) સભાપતિની પરવાનગીથી અન્ય કોઈ કામ

ઉપરાંત ઓડિટ સમિતીની બેઠક શુક્રવાર, 13 ઓગસ્ટ, 2021ના રોજ બપોરે 3:00 કલાકે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ખાતે યોજાશે.

સેબી (પ્રોહિબિશન ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ) રેગ્યુલેશન્સ 2015 ના અનુસંધાનમાં કંપનીના નિયુક્ત વ્યક્તિઓ દ્વારા નિયમનની આચારસંહિતા અનુસાર, મોનિટર ટ્રેડિંગ, કંપનીની ટ્રેડિંગ વિંડો 1 જુન 2021 થી બંધ છે અને જે ૪૮ કલાક પછી ક્વાર્ટર નાણાંકીય પરિણામો સ્ટોક એક્સચેન્જમાં સબમીટ થયા પછી ફરી ખુલશે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે અને વતી, સાનબ્લ્યુ કોર્પોરેશન લિમિટેડ Sd./-

ક્થળ : અમદાવાદ તારીખ: 29/07/2021

જોશ ડેનીચલ મેનેજીંગ ડાચરેક્ટર - DIN: 03532474

### પશ્ચિમ રેલવે – રાજકોટ ડિવિઝન

<u>ચા અને નાસ્તા સ્ટૉલના કોન્ટ્રાક્ટ માટેનું ટેન્ડર</u> ટેન્ડર નં. ડીઆરએમ/કોમર્શિયલ/01/2021 તા.30-07-2021

**કામનું નામઃ** રાજકોટ ડિવિઝનના 'A1, A & B' ક્લાસ સ્ટેશન એટલે કે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ઓખા, ાંકાનેર અને હાપા સ્ટેશનોના જનરલ માઈનોર યુનિટ્સ ખાતે બે પેંકેટ સિસ્ટમ હેઠળ ચા અને નાસ્તા સ્ટોલ (નોન પ્રાઈમ

ું. સું. મું	ટેન્ડર નોટીસ નં.	કેટરીંગ સ્ટોલનું સ્થાન	કેટેગરી	રિઝર્વ કિંમત (પ્રતિ વર્ષ*)	ઈએમડી
01	C45/GMU/JAM/PF -02-03/01	જામનગર સ્ટેશન પર PF નં.02- 03ના પીલ્લર નં. 06 અને 07 વચ્ચે	સ્ત્રીઓ (Gen)	1,46,000	15,200
02	C45/GMU/JAM/PF No. 02-03/02	જામનગર સ્ટેશન પર PF નં. 02- 03ના પીલ્લર નં. 01 અને 02 વચ્ચે	Gen	1,46,000	15,200
03	C45/GMU/OKHA/ PF 02-03/01	કવર શેડ હેઠળ, ઓખા સ્ટેશન પર PF નં. 02-03 ના પોર્ટ અંત તરફ	Gen	1,24,000	12,900
04	C45/GMU/OKHA/ PF-01/02	C & W/ઈલેક્ટ્રિક ઓફિસ પાસે, ઓખા સ્ટેશન પર PF નં.01ના રાજકોટ અંત તરફ	Gen	1,78,786	18,600
05	C45/GMU/WKR/ CIRCULATING/01	વાંકાનેર સ્ટેશન પર સરક્યુલેટીંગ વિસ્તાર ખાતે FOB લેન્ડીંગ પાસે	Gen	54,000	5,700
06	C45/GMU/HAPA/ CIRCULATING/02	હાપા સ્ટેશન પર સરક્યુલેટીંગ વિસ્તાર ખાતે રાજકોટ તરફ-ગાર્ડન સામે	Gen	52,500	5,500
07	C45/GMU/HAPA/ CIRCULATING/03	હાપા સ્ટેશન પર સરક્યુલેટીંગ વિસ્તાર ખાતે રાજકોટ તરફ-ગાર્ડન સામે	સ્ત્રીઓ (Gen)	52,500	5,500
08	C45/GMU/JAM/ CIRCULATING/01	જામનગર સ્ટેશન પર સરક્યુલેટીંગ વિસ્તાર ખાતે હાલની ATM સાઈટ પાસે	Gen	1,80,000	18,800
09	C45/GMU/SUNR/ CONCOURSE/01	સુરેન્દ્રનગર સ્ટેશન પર બુકિંગ ઓફીસ અને ઈન્ક્વૉયરી ઓફીસ સામે	સ્ત્રીઓ (Gen)	1,80,000	18,800
10	C45/GMU/RJT/PF No.01-04/05	લાઈન નં. 03/04 ના હાઈડ્રેન્ટ નં. 107 સામે,	Gen	2,28,690	23,800
11	C45/GMU/HAPA/ PF No.01/01	બુકિંગ / રિઝર્વેશન ઓફીસ પાસે	Gen	1,19,790	12,500
12	C45/GMU/SUNR/ PF-01-04/01	સુરેન્દ્રનગર સ્ટેશન પર PF નં. 01 - 04 ના પીલ્લર નં. 14 અને 15 વચ્ચે	Gen	4,00,000	41,600
13	C45/GMU/SUNR/ PF-02-03/02	સુરેન્દ્રનગર સ્ટેશન પર PF નં. 02- 03 ના પીલ્લર નં. 12 અને 13 વચ્ચે	Gen	3,21,786	33,470

**ટેન્ડર ફોર્મ ફીઃ** ₹ 5,900/-, \*પહેલા ત્રણ વર્ષ માટે લાયસન્સ ફી નિશ્ચિત રહેશે. ચોથા વર્ષે તેમાં 10%નો વધારો થર્ ાથા અને પાંચમાં વર્ષે લાસયન્સ ફી સમાન રહેશે. **શરૂઆતની તારીખઃ** ડિવિઝનલ રેલવે મેનેજર (કોમર્શિયલ)-રાજકો દારા સલાહ મુજબ. **ટેન્ડર બંધ થવાની અને ખુલવાની છેલ્લી તારીખ અને સમયઃ** તા.06–09–2021 ના 15:00લાકે અને તા.06–09–2021 ના 15:30 કલાકે. ઉપરોક્ત બધા જ ટેન્ડરો માટે. **કોન્ટ્રાક્ટનો કાર્યકાળઃ** ફક્ત 05ાર્ષના સમયગાળા માટે. નવું વિસ્તરણ/નવીનીકરણ નહિં. **ટેન્ડરની માન્યતાઃ** 180 દિવસ. **ઓફીસનું સરનામું જ્યાં ટન્ડરની વિગતો ઉપલબ્ધ છે :** સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફીસ, ડિવિઝનલ રેલવે મેનેજર ઓફીસ કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ-360001. બધા કામકાજના દિવસો દરમિયાન 10:00 કલાક થી 17:00 કલાક ોબસાઈટઃ <u>www.wr.indianrailways.gov.in</u>

અમને લાકક કરોઃ 📑 facebook.com/WesternRly∙ અમને ફોલો કરોઃ 🔀 twitter.com/WesternRly



Place: Himmatnagar

Date : 02.08.2021

CIN: L65910GJ1990PLC014516 Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg., Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India

21

(Rs.in Lacs) PARTICU For the nded No year 30 June 2021 31 March 2021 30 June 2020 31 March 2021 Unaudited Audited Unaudited Audited 488.89 1. Total Income From Operations 113.94 139.94 98.14 2. Net Profit/(loss) for the period (before Tax, Exceptional and/or 68.43 76.91 330.86 Extraordinary items) 30.43 3. Net Profit/(loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items) 68.43 76.91 30.43 330.86 4. Net Profit/(loss) for the period after Tax(after Exceptional and/or Extraordinary items) 49.61 57.79 22.34 252.43 5. Total Comprehensive Income for the period (Comprising Profit /(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax) 49.61 57.79 22.34 252.43 6. Paid up Equity Share Capital 655.82 655.82 655.82 655.82 Earnings Per share (of Rs 10/each) (for continuing and discontinuing operations)-Basic: 0.76 0.88 0.34 3.85 3.85

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Reguirements) Regulations, 2015.

> Sd/- (D.N.Gandhi) Managing Director

# NALIN LEASE FINANCE LIMITED

Phone: 02772-241264, 242264, email: nalinlease@yahoo.co.in, www.nalinfin.co.in

જો આ દેવાદાર ઉપરોક્ત ાાદા, મદાને ચૂકવણી કરવામાં નિષ્કળ જાય તો ાાદા, મદા આ એક્ટની કલમ ૧૩(૪) હેઠળ ઉપરોક્ત સિક્યોર્ડ એસેટ્સ સામે કાર્યવાહી હાથ ધરશે અને લાગુ થતા નિયમોસમગ્રપણે તે દેવાદારના જોખમે અને ભોગે રહેશે. વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશ્રીની બ્રાંચ ઓફીસ: અમદાવાદ કોમસે હાઉસ, ચોથો માળ, કોમસે હાઉસ, જે, શેલ પેટ્રોલ પેપની પાસે, આનંદનગર રોડ, પ્રહલાદનગર, અમદાવાદ-૩૮૦૦૫ () અથવા બાંચ ઓફીસ: ઓફીસ નં.7ળ, સાતમો માળ, ટાફ સેન્ચ્યુરી બિઝનેસ સેન્ટર ઉપના દરવાજા પાસે, રીગ કોડ, સુરત-૩૯૫૦૦૦/ (બ્રાંચ ઓફિસ: -૩૦૩, ત્રીએમ માળ, ભગવાદાદા ચેખ્યસે, સર્કિટ હાઉસની સામે, આર.સી. દત્ત રોડ, વડોદરા, પીનકોડ-૩૯૦૦૦૭/અથવા **કોમોરેટ ઓફિસ** આઈઆઈએકએલ ટાવર પ્લોટ ને.૯૮, દેસ-૪, ઉદ્યોગ વિહાર, ગુરગાંવ, હરીયાણા સંપર્ક કરવો.

	ANDALONE UNAUDITED FINAN UARTER ENDED ON 30.06.202
ILARS	For the quarter en

The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) &

For, NALIN LEASE FINANCE LTD

month of July 2021

Business Brief III

Toyota Kirloskar Motor today announced that the

company sold a total of 13,105 units in the month of

July 2021, thereby registering a growth of 143% when compared to the domestic sales in the month

of July 2020. The company also clocked a 49% growth

in domestic sales when compared to sales made in

June 2021. For reference, TKM had reported wholesales of 5386 units in the month of July 2020 and

WiselineSigamani, Associate General Manager (AGM),

Sales and Strategic Marketing, Toyota Kirloskar

Motorsaid, "July has been a good month for us as we

have witnessed a significant surge in both demand

as well as wholesales numbers, second month in a

row. Our pending orders were already very encour-

aging since June and in July, our retail sales have also

been promising thereby drastically bringing down the gap between wholesales and retail figures. The Innova Crysta and the Fortuner deserve a special

mention here as both these models have significantly contributed to our total sales, thereby reiterating their segment leadership positioning in their respec-

tive segments. Even the Glanza and Urban Cruiser are doing consistently well month on month, especially

owing to the need for personal mobility in the post

Skoda Auto India sales increase

ŠKODA AUTO, the Czech Marque, announced a

234% increase in its July 2021 sales, compared to the

same period last year. The company sold 3,080 cars

in July 2021, compared to 922 cars sold in July 2020.

**234% in July** 

Commenting on the monthly sales, Mr. V.

8801 units in the month of June 2021.

TKM registers a 143% growth in

# Krsnaa Diagnostics IPO opens August 4 Ahmedabad, 33,40,713 equity shares by uity shares and in multiples

Krsnaa Diagnostics Rs 1,213-crore IPO will open for subscription on Wednesday, 4 August 2021, at a price

Krsnaa Diagnostics Rs 1,213-crore IPO will open for subscription on Wednesday, 4 August 2021, at a price band of Rs 933-954 per share of face value of Rs 5 each. The public issue comprises a fresh issue of shares worth Rs 400 crore and an offer for sale (OFS) of up to 85.25 lakh equity shares by existing selling shareholders.The offer for sale consists of sale of 16 lakh equity shares by PHI Capital Trust-

PHI Capital Growth Fund-I;

By Subhash Narayan

a rude shock as the govern-

ment has not completely

done away with the process

of including the reconcilia-

tion statement along with

reconciliation statement to

tally with the numbers

given in the annual returns

is always a challenge for tax-

payers and even tax experts

face problems in finalising

According to a notifica-tion issued by the Central

Board of Indirect Taxes and Customs (CBIC) late on Fri-

day evening, every regis-

tered person, other than

specified persons, whose

aggregate turnover during a

FY exceeds Rs 5 crore, will be

required to furnish a self-

certified reconciliation

statement as specified un-

Hopes of faster eco-

nomic rebound, along with,

healthy auto sales data and

GST collections lifted India's

equity markets during the

pre-noon trade session on

Monday. Initially, the equity

markets had a gap up open-

ing due to positive global

cues and investors' opti-

mism over healthy Q1FY21

results. Sector wise, realty

and oil and gas indices have

gained the most in early

Consequently, the BSE Sensex traded at 52,946.95

points, at 11.35 a.m., higher

by 360.11 points or 0.68 per

cent from its previous close.

tional Stock Exchange

traded at 15,873.40, higher

by 110.35 points or 0.70 per

cent from its previous close.

opened gap up and has re-

mained in a range since

then. Asian markets recov-

CHANGE OF NAME

I have changed my old name

from NIRAV HITESH BAROT

to new name NIRAV

HITENDRA BRAHMBHATT

Add.: 1, Ambikanagar,

Thaltej, Ahmedabad

CHANGE OF NAME

I have changed my old name from RIYA MURLIDHAR

MOHIT GALLANI Add.: F-

703, River Vally-1, Hasol,

Sardarnagar, Ahmedabad

CHANGE OF NAME

I have changed my minor

daughter old name from **UMAMAH MOABBID** 

MANSURI to new name

UMAMAH

MOHAMMADMOABBID

MANSURI Add.: 2814, Raja

Mansion, Opp. Satyam Soc, Shahpur Mill Compound,

Ahmedabad

CHANGE OF SURNAME

I have changed my old

surname from ANJUMBIBI

CHAINANI to new name RUHI

"Indian equity market

The Nifty50 on the Na-

trade.

The preparation of the

the returns.

band of Rs 933-954 per share of face value of Rs 5

Kitara PIIN 1104; 35,63,427 equity shares by Somerset Indus Healthcare Fund I; and 21,380 equity shares by Lotus Management Solutions (acting through Mayur Sirdesai). The total offer size

comes to Rs 1,213.33 crore. In the grey market, Krsnaa Diagnostics shares were seen trading at Rs 1,364 apiece, Rs 410 or 43 per cent premium over the IPO price, according to the people who deal in the unlisted shares of companies. Krsnaa Diagnostics IPO will be among four public issues to open on 4 August 2021 along with Devyani International, Windlas Biotech, and Exxaro Tiles. Investors can bid for a minimum of 15 eq-

théreafter, implying a minimum investment of Rs 14,310 per lot at the upper end of the price band. Up to 75 per cent of the net offer (or Rs 881.57-895 crore) will be reserved for Qualified Institutional Buyers (QIBs), 15 per cent (or Rs 176.31-179 crore) for non-institutional investors and the remaining 10 per cent (or Rs 117.54-119.33 crore) for the retail investors. The offer also includes a reservation of shares worth Rs 20 crore for employees, who will a discount of Rs 93 per share to the final issue price.JM Financial, DAM Capital Advisors, Equirus Capital, and IIFL Securities are the book running lead managers

## WR Crossed Rs. 100 cr mark in scrap sale during current financial year

Western Railway is committed to make all its railway establishments and units, scrap free under the "Mission Zero Scrap". Under the dynamic leadership & valuable guidance of Shri Alok Kansal – General Manager of Western Railway, in the current financial year, Western Railway has crossed the big figure of Rs 100 crore by scrap sale.

According to a press re-lease issued by Shri Sumit Thakur – Chief Public Relations Officer of Western Railway, it is worthwhile to mention that despite the uncertain and difficult time

tification basis," Singhania

said. While clarifying on an-

nual filing requirement for

taxpayers, the CBIC notifica-

taxpayers.

tion has gone with

changes incorporated

in the Finance Act,

2021 for easing the

compliance burden on

Accordingly, it has exempted registered persons whose aggregate turnover in FY 2020-21 is upto Rs 2 crore from filing of annual GST return It is

nual GST return. It is

not clear whether tax-

payers with turnover

reconciliation statement

along with annual returns.

However, going by prece-

dence such taxpayers may

be given the option on filing

the reconciliation state-

CHANGE OF NAME

Western Railway not only achieved the onerous task of scrap sale target of Rs. 410 crores in the financial year 2020-21, but also surpassed it by a substantial margin of 20%. Western Railway sold scrap worth Rs. 491.04 crores in 2020-21, making it highest amongst all Zonal Railways & Production Units of Indian Rail-

Shri Thakur added that in the past three years, Western Railway has been consistently selling scrap of approx. Rs 500 crores which has helped in monetization of blocked funds and con-

sequent revenue generation. Continuing with its march of Mission Zero Scrap, Western Railway became the first Railway to cross first milestone of Rs.100 Crs on 30th July, 2021 by selling scrap worth Rs.102.32 crores till 30th of July 2021. Under the directives of General Manager Shri Kansal and Principal Chief Materials Manager Shri D.K. Shrivastava, Western Railway has set its target to make the Zonal Railway completely scrap free & aims to achieve 100% scrap free status at all its workplaces by the end of current year.

# No change in petrol, diesel

The oil marketing com-

The pump price of fuel has been static since July 18. One of the main reasons

an over 10 per cent fall seen in global oil prices with benchmark crude sliding to \$69 a barrel earlier last month. It had again risen close to around \$75 a barrel on strong demand projections. With OPEC reaching an agreement to raise crude production, oil prices are expected to remain soft. This

after a long interval.

In the city of Mumbai. metros have now crossed Rs 100 per litre mark.

The fortnight long price pause comes after fuel prices increased on 41 days and remained unchanged on 50 days since May 1. The 41 increases have taken the petrol prices up by Rs 11.44 per litre in Delhi. Similarly, diesel has increased by Rs 9.14 per litre in the national capital. Since April 2020, petrol prices have increased by Rs 32.25 per litre from Rs 69.59 a litre to Rs 101.84 a litre now in Delhi. Similarly, diesel price during the period has increased by Rs 27.58 per litre from Rs 62.29

### prices for 16 straight days New Delhi, prices in India to actually for prices in India to actually fall

where petrol prices crossed Rs 100 mark for the first time on May 29, the fuel price is at Rs 107.83 per litre. Diesel price in the city is also at Rs 97.45, the highest among metros. Petrol prices in all

> Mr. Zac Hollis, Brand Director - ŠKODA AÚTO India, said, "KUSHAQ was launched with the vision of substantially growing our volumes in India, and it is very encouraging to see our plan taking shape. Despite a challenging environment, we have managed to have a really successful launch, which is in line with our strategic focus and volume expectations. Moreover, the new launch has enabled us to build a strong momentumacross the value chain. We are seeing a surge in dealership footfalls and customer enquiries. Sales in June 2021 stood at 734 units, which account for a 320% increase in July 2021 sales over June 2021. As per the company's strategy, the surge in sales is fuelled by the launch of KUSHAQ, which will be one of the important growth drivers of the brand going

### NTPC Q1 net profit rises 27.35% to over Rs 3,000 cr

New Delhi.

Mumbai,

The country's largest power generator NTPC Ltd. has reported 27.35 per cent increase in its net profit during the first quarter of current fiscal on the back of higher generation and improved demand for power. The company reported Q1 FY22 net profit of Rs 3,145.63 crore as against Rs 2,470.16 crore in Q1 The total income during the period under review

stood at Rs 26,802.25 crore as against Rs 24,021.00 crore in the same period previous year, registering an increase of 11.58 per cent. In the April-June quarter NTPC group recorded gross generation of 85.81 billion units as against 67.94 billion units during the previous quarter of last year. On standalone basis, the gross generation of NTPC for Q1 FY22 was 71.75 Billion units as against 60.19 billion units in the previous quarter of last year. Coal stations achieved a Plant Load Factor of 69.68 per cent as against National Average of 58.50 per cent with an availability factor of 93.68 per cent. NTPC Group present installed capacity is 66,885 MW.—IANS

### Positive global cues, hopes of healthy 01 lift indices

Mumbai,

Positive global cues from Asian indices along with domestic hopes of more healthy quarterly results lifted India's equity markets during the morning trade session on Monday. Initially, the equity markets had a gap up opening due to positive global cues. Consequently, the BSE Sensex traded at 52,868.36 points, at 10.15 a.m., higher by 281.52 points or 0.54 per cent from its previous close. The Nifty50 on the National Stock Exchange traded at 15,851.55, higher by 88.50 points or 0.56 per cent from its previous close. —IANS

### Covid shadow: Auto Expo 2022 postponed

The prevailing threat of a third Covid wave has led to postponement of Auto Expo 2022.

Accordingly, the motor show which was originally slated to have been held from February 2-9, 2022 at the India Expo Mart in Greater Noida has been postponed. The organiser of the show - Society of Indian Automobile Manufacturers - said the exact date for the next edition of 'Auto Expo - The Motor Show' would be finalised later this year. "Safety of 'Exhibitors, Visitors' and all stakeholders involved and present at the Expo is the topmost priority for SIAM," It is in this context that the Indian automobile industry and SIAM recognises the inherent risks in organising the Auto Expo due to the on-going Covid-19 Pandemic and the apprehensions of a possible third wave."

There is uncertainty, he said, around how Covid-19 would develop in the coming months and at the same time organising auto expo would need a lead time of preferably a year.

## Rs 5 cr turnover, reconciliation statement remains also puts a responsibility on taxpayers to furnish details in Annual Return on true and correct basis on self-cer-

panies (OMCs) continued to pause fuel price revision for the sixteenth consecutive day on Monday, the longest period in weeks, as wait and watch continues amidst rising global crude prices.

Accordingly, in the national capital, petrol continues to be sold for Rs 101.84 per litre, while diesel is also being sold at the unchanged price of Rs 89.87 a litre on Monday.

for pause in fuel price rise is

could make way for fuel

to Rs 89.87 a litre in the national capital. **EVTRIC Motors launches 2 slow-**

speed electric scooters in India

Automotive start-up EVTRIC Motors on Monday launched its first electric scooters in the slow-speed category — EVTRIC AXIS and EVTRIC RIDE — for Rs 64,994 and Rs 67,996, respectively. The company said that the booking will soon open online and offline with zero booking amount on its website, along with select e-tailers. The e-scooter comes with a detachable lithiumion battery option that provides the users with the convenience of charging. The scooters have a loading capacity of 150 kgs, clocking a motor power of 250W. Both the e-scooters take around 3.5 hours of charging time for a full battery, covering a distance of over 75 kms on a single charge, with a top speed of 25 kms per hour, the company said in a statement. "We have begun with the slow-speed e-scooters category, as we understand, given the current technology this would be a justified buy for the day-to-day commute of users. These products will fall in line with the customer expectations leaving them w economic travel and smooth experience," said Manoj Patil, MD and Founder, EVTRIC Motors.

### CHANGE OF SURNAME

I have changed my old surname from **ANIS** (ASAMBHAI JAWARAWALA to ANIS KASAMBHAI **JAWRAWALA** Add.: 2427, Gajipir

Kumbharwada, Jamalpur, Ahmedabad-380001

# CHANGE OF SURNAME

I have changed my old surname from **DILIPKUMAR** ATMARAM PANCHAL to **DILIPBHAI ATMARAM** UHAR Add.: 2778, Rupapa Dariapur, Ahmedabad-380001 CHANGE OF SURNAME

I have changed my old urname from **AMRIN HARUN** JAWARAWALA to AMRIN HARUN JAWRAWALA Add.: 2427, Gajipir Kumbharwada, Jamalpur, Ahmedabad-380001 1257

(Rs.in Lacs)

**CHANGE OF SURNAME** 

I have changed my old surname from NASIMBANU

KASAM JAVARAVALA to

NASIM KASAM

**JAWRAWALA** 

Add.: 2427, Gajipir

Kumbharwada, Jamalpur, Ahmedabad-380001

Basic:

Place : Himmatnagar

Date : 02.08.2021

#### NALIN LEASE FINANCE LIMITED CIN: L65910GJ1990PLC014516

Regd.Off: Ground Floor, Gandhi Nursing Home Bldg. Dr.Nalinkant Gandhi Road, Himatnagar- 383 001. Gujarat India Phone: 02772-241264, 242264, email: nalinlease@yahoo.co.in, www.nalinfin.co.in

1257

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL **RESULTS FOR THE QUARTER ENDED ON 30.06.2021** 

SI. No.	PARTICULARS	For the quarter ended			For the year ended
		30 June 2021	31 March 2021	30 June 2020	31 March 2021
		Unaudited	Audited	Unaudited	Audited
1.	Total Income From Operations	113.94	139.94	98.14	488.89
2.	Net Profit/(loss) for the period				
	(before Tax, Exceptional and/or				
	Extraordinary items)	68.43	76.91	30.43	330.86
3.	Net Profit/(loss) for the period				
Ш	before Tax (after Exceptional				
	and/or Extraordinary items)	68.43	76.91	30.43	330.86
4.	Net Profit/(loss) for the period				
	after Tax(after Exceptional				
Ш	and/or Extraordinary items)	49.61	57.79	22.34	252.43
5.	Total Comprehensive Income for the				
	period (Comprising Profit /(Loss)				
	for the period (after Tax) and Other				
Ш	Comprehensive Income (after tax)	49.61	57.79	22.34	252.43
6.	Paid up Equity Share Capital	655.82	655.82	655.82	655.82
8.	Earnings Per share (of Rs 10/-				
	each) (for continuing and				
	discontinuing operations)-				

changes under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. Company's website (www.nalinfin.co.in)

For, NALIN LEASE FINANCE LTD Sd/- (D.N.Gandhi) Managing Director

0.34

3.85

3.85

#### der section 44 in FORM GSTR-9C along with the annual returns.

New Delhi, Taxpayers looking at While the notification brings clarity over filing of ease of compliance requirement for filing annual GST returns for 2020-21 are in for annual GST returns for FY21,

> reconciliation statement a GSTR 9 itself now. In simple words, GSTR 9C existing currently

m o v e d and has been made a part of GST Annual Return GSTR 9.

Healthy sales, tax data buoy

indices; realty stocks' gain

"So, taxpayers having aggregate turnover above Rs 5 crore need to file selfcertified reconciliation statement even for FY 2020-21 as a part of Annual Return. The notification has brought charity over this as-

ered from morning lows,'

said Deepak Jasani-Head of

Retail Research at HDFC Se-

"Nifty could face resis-

pect of compliance," said Aditya Singhania, partner at Singhania GST Consultancy.

Compliance not eased for GST taxpayers with over

to the issue.

He added that the notification has also done away

with the requirement of filit has made self-certified ing a GST reconciliation statement certified by char-

3Xbahei, tered accountants (CAs) or between Rs 2 and Rs 5 crore would be required to attach

cost and works accountants (CWAs). "This should allow other professionals including legal counsellors working on GST cases to take up the preparing of reconciliation statement for taxpayers wherever required. But it

## ment.—IANS

I have changed my old name from **SHYAMKUMAR** HEMANGBHAI PATEL to nev name SHYAM **HEMANGKUMAR PATEL** Add.: A-66, Rima Park

Society, B/h Raichandnagar Motera, Sabarmati Ahmedabad-380005

### TENDER FOR THE CONTRACT OF TEA & REFRESHMENT STALL

Tender No. DRM/COMML/04/2021 DATED 30-07-2021 Name of Work: "Tender for the Contract of Tea & Refreshment Stall (Non Prime Location) at Special Minor Unit (SMUs) Reserved for Schedule Caste and Schedule Tribes of the 'A&B' Class Station i.e. Surendranagar & Hapa Station of Rajkot Division

) -	Sr. No.		Location of Catering Stall	rved	Price (Per Annum*)	EMD	
	01	C45/SMU/HAPA/ CIRCULATING/01		sc	52,500/-	5,500/-	
		C45/SMU/SUNR/ CIRCULATING/01	Near New FOB landing at circulating area at Surendranagar		1,80,000/-	18,800/-	
s I	Tender Form Fee: ₹ 5,900/-, *License fee will be fixed for the first three years and it						

the fourth year, it will be enhanced by 10% Licence fee for the fourth and fifth year will remain same. SC = Scheduled Caste, ST = Schedule Tribes. Date of Commencement: As advised by Divisional Railway Manager (Comm.)-Rajkot, Date and Time of Closing of Tender and Opening of Tender: On 06-09-2021 at 15:00 Hrs. and On 06-09-2021 at 15:30 Hrs. for all above Tenders. Tenure of Contract: For a period of 05 years only. No further extension/renewal. Validity of Tender: 90 days. Address of the office from where the details will be available: Office of Sr. Divisional Commercial Manager, Divisional Railway Manager Office, Koth Compound, Rajkot-360001. During the all working days from 10:00 hrs. to 17:00 hrs. **Website address:** <u>www.wr.indianrailways.gov.in</u> Like us on: 

f facebook.com/WesternRly • Follow us on: 

twitter.com/WesternRly

## Surbhi Industries Limited

CIN NO. L17110GJ1992PLC017672 Regd.off: "SURBHI HOUSE", 2nd Floor, F. P. No. 206, B/h Old Sub-Jail, Ring Road, Khatodara, SURAT GUJARAT 395002 NOTICE

Pursuant to Regulation 47 read with Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, NOTICE is hereby given that a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on 10thday of August month 2021, at 12.15 PM at registered office of the companyinter alia, to consider, approve and take on record the Unaudited Financial Results of the Company for the quarter ended 30thJune 2021.

Further, details are also available onCompany's website www.surbhi.com as well as Stock Exchange's website i.e. www.bseindia.com. By order of the Board

For, SURBHI INDUSTRIES LTD.

Date :02.08.2021

**RAVJIBHAI PARBATBHAI PATEL** Place : Surat Managing Director (DIN: 00023332)

SANBLUE CORPORATION LTD. Reg. off: 22-A, Government Servant Society, Near Municipal Market, C.G. Road. Ahmedabad-380009. Email: inquiry@sanbluecorporation.com • Website: www.sanbluecorporation.com

CIN: L15400GJ1993PLC020073 NOTICE **Sub: Intimation Of Board Meeting** 

For The First Quarter Ended On 30th June, 2021 **NOTICE** is hereby given that the meeting of the Board of Directors will be held on Friday, 13th August, 2021 at 4:00 p.m. at Registered Office of the Company to consider and approve

- following business(s): 1. Adoption of Unaudited Quarterly Financial Results of the Company for the first quarter ended on 30th June, 2021
- 2. Any other business with permission of chair.

Notice further that meeting of the Audit Committee will be held on Friday, 13th August, 2021 at 3:00 p.m. at Registered Office of the Company.

Please Report be also advised that in accordance with code of conduct to Regulate, Monitor trading by Designated persons of the Company pursuant to SEBI (Prohibition of Insider Trading) Regulations 2015, the Trading window of the company is already closed from 1st June, 2021 and shall reopen 48 hours after the quarterly Financial Results to be submitted to the Stock Exchange.

> For and on behalf of the Board of Directors **Sanblue Corporation Limited**

> > **Jose Daniel**

Place: Ahmedabad Date: 29/07/2021

Managing Director - DIN: 03532474

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Ex-The full format of the Quarterly Financial Results is available on the BSE website (www.bseindia.com) &

0.76

0.88

TENDER NOTICE NO. 05 OF 2021-22

D.W.S.U. (Wasmo) Ahmedabad.
Unit Manager, District Water and Sanitation Unit, WASMO,
Ahmedabad Gujarat State invites on-line tenders on behalf of different Villages pani samittee for below mentioned work.

1. Name of work: Total nos. of 38 (village), Water Supply Scheme work for different villages having tender ID No. 475662, 475663, 475664, 475665, 475666, 475668, 475669, 475672, 475674, 475677, 475678, 475680, 475687, 475688, 475689, 475689, 475689, 475689, 475688, 475689,

475697, 475699, 475700, 475702 475704, 475705, 475707, 475711, 475716, 475718, 475722 475725, 475731

2. Total Estimated Cost : 920,22,469.00

3. Last date of on-line submission of tender: Up to 20.08.2021 4. Last date of physical documents submission of tender

 Last date of physical documents submission of tender:
 1.08.2021 up to 18.00 hrs.
 Tender Opening date: 23.08.2021 11.00 Hrs.
 Eligibility: The tender is in too bid system. The bidders who are registered (Civil) in 'R & B Department of Gujarat State in Appropriate class' are eligible. Hard copy of tender documents will accepted by R.P.A.D./Speed post/ Hand to Hand only. Further information is available on website www.nprogure.com available on website www.nprocure.com, www.statetenders.gujarat.gov.in. The further changes in traders will be done on-line only. WASMO reserve rights to reject any or all

tenders without assigning any reasons. All the details and conditions of tenders is available on-line.

Note: Certificate for exemption of earnest money deposit will not be acceptable For any water related complaints/ suggestions contact toll free number 1916

No.INF/ABD/648/2021

Ahmedabad, Page 7

# NIT has been uploaded on Railway Vebsite www.ireps.gov.in on 30-07-2021

KASAMBHAI JAWARAWALA to ANJUM KASAMBHAI **JAWRAWALA** Add.: 2427, Gajipir Kumbharwada, Jamalpur, Ahmedabad-380001

RESTORATION OF OFC HUTS OF MG SECTION E-Tender No. 39/2021-22. Name o Work: Bhavnagar Division: Restoration of OFC huts of MG section in connection with the damaged by Cyclone Tauktae (As per list attached) **Tender Value** ₹ 37,02,206.84 EMD: ₹ 74,100.00 Date of Bidding Start Date: 13-08-2021. Date of Bidding Closing: 27-08-2021. The

**WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION** 

Follow us on: twitter.com/WesternRly

# CHANGE OF NAME

I have changed my old name from JYOTIBALA MODI

Township Narmada College,

tance at 15,899. Our markets will look at the Asian and European markets later for cues for further rise.' According to Likhita Chepa, Senior Research Analsyst at CapitalVia Global Research: "Indian benchmark indices started with a

gap up after the positivity ir ments got the boost as GS collection recovered to three-month high in July exceeding Rs 1.1 trillion, as economic activity resumed. Technical indicators also support positivity in the market.""İf the Delta variant of the corona virus is kept in control, we can expect the

economic activities getting

back to pre-covid levels very

### **RASHIKLAL MODI** to new ame JYOTI JAYESHKUMAR

Add.: 169, Shri Rang

Tavda Road, Zadeshwar,

**WESTERN RAILWAY - RAJKOT DIVISION** 

ĺ	under einigier dekereystern .						
	Sr. No.		Location of Catering Stall	rved	Reserve Price (Per Annum*)		
	01	C45/SMU/HAPA/ CIRCULATING/01	Near Running Room at circulating area at Hapa Station	sc	52,500/-	5,500/-	
I	02		Near New FOB landing at		1,80,000/-	18,800/-	

#### CHANGE OF NAME OLD NAME: LEUVA HASMUKHKUMAR **PURSHOTTAMBHAI NEW NAME: LEUVA HASMUKHBHAI PURSHOTTAMBHAI** ADD: AT. PO. Moyad-Nathaji,

Ta. Prantij, Dist. Sabarkantha-383120